FINANCIAL EXPRESS



CIN: L70102TG2008PLC059173

Read. Office: Flat Nos. 306 & 307, 3rd Floor, 1-8-271, to 273, Ashoka Bhoopal Chambers, S.P. Road Secunderabad - 500 003 (TG) Corp. Office: TCI House, 69 Institutional Area, Sector-32, Gurugram -122 001, Haryana

Tel: +91 124 2381603-07 | E-mail: secretarial@tcidevelopers.com Website: www.tcidevelopers.com

NOTICE OF 17TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 17th Annual General Meeting ('AGM') of TCI Developers Limited ('the Company'), will be held on Thursday, September 25, 2025 at 11:00 a.m. (IST) through Video Conference ('VC') / Other Audio Visual Means ('OAVM') to transact the businesses as set out

in the Notice convening the AGM which will be circulated to the Members. This is in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder, read with the Ministry of Corporate Affairs ('MCA') General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 10/2022 dated December 28, 2022, 09/2023 dated September 25, 2023 and subsequent circulars issued in this regard, the latest being 09/2024 dated

September 19, 2024. (Collectively referred to as "MCA Circulars"). In accordance with the aforesaid MCA Circulars, the Notice of the AGM along with the Annual Report of the Company for the Financial Year 2024-25 will be sent electronically to those Members whose e-mail addresses are registered with the Company/ National Securities Depository Limited. ("NSDL") and "Central Depositories"/"DPs")/Registrar & Transfer Agent ("Registrar"/"RTA").

It is requested to the shareholders who have not yet registered their email addresses, to register their e-mail IDs temporarily in respect of shares held in dematerialised form, with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form through an e-mail to the Registrar and Share Transfer Agent (RTA) of the Company, KFin Technologies Ltd., Selenium Tower B, Plot number 31 & 32, Financial District Gachiboli, Hyderabad 500 032, Tel:+91 040 67161524, email: einward.ris@kfintech.com or to the Company at secretarial@

The Company shall send a physical copy of the Annual Report to those Members who request for the same at secretarial@tcidevelopers.com or $\underline{einward.ris@kfintech.com}\ mentioning\ their\ Folio\ no./DP\ ID\ and\ Client\ ID.$

The e-copy of the Notice along with the Annual Report, Financial Statements and other Statutory Reports will be available on the website of the Company at https://tcidevelopers.com/annual-report.html and on Central Depository Securities Limited (CDSL) website at www.eyotingindia.

Members can attend and participate in the AGM through the VC/OAVM facility only and their attendance shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The instructions for joining the AGM are provided in the Notice of the

Pursuant to the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended), the Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India and the MCA Circulars, the Company will provide the facility of remote e-Voting to its Members in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed CDSL to facilitate voting through electronic means. Accordingly, the facility of casting votes by a Member using remote e-Voting system before the AGM as well as remote e-Voting during the AGM will be provided by CDSL. Detailed procedure for remote

e-Voting is provided in the Notice of the AGM. The remote e-Voting facility would be available during the following period: Commencement of e-Voting From 9.00 a.m. (IST) on Monday, September 22, 2025

The Notice calling the AGM will also be made available on the website of the Company at https://tcidevelopers.com/annual-report.html The Company is providing remote e-voting facility to all the shareholders to cast their votes on all resolutions set out in the notice of the AGM as well as through e-voting system during the AGM through the platform of CDSL. The Shareholders whose email addresses are not registered with the depositories/Company for obtaining login credentials for e-voting for the resolutions proposed in the notice calling the AGM, are $requested to email to the company on \underline{secretarial@tcidevelopers.com} \label{lem:company} The detailed procedure for remote e-voting will be provided in the Notice.$ Members are requested to update bank account mandate for receipt of dividend directly in their bank account through their Depository Participant(s) in respect of shares held in dematerialised form and in respect of shares held in physical form to the RTA by providing request letter alongwith Cancelled cheque.

Upto 5.00 p.m. (IST) on Wednesday, September 24, 2025

For TCI Developers Limited

Place: Gurugram Date: 29th August, 2025

End of e-Voting

(Bhavna Sharma) Company Secretary

A74445



GRAVISS HOSPITALITY LIMITED

CIN: L55101PN1959PLC012761

Regd office: Plot no. A4 & A5, Khandala MIDC, Phase II, Kesurdi, Khandala, Satara- 412 801 (Maharashtra).

NOTICE OF THE SIXTY FOURTH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the Sixty Fourth Annual General Meeting ("AGM") of the Members of Graviss Hospitality Limited will be held through Video Conferencing("VC")/Other Audio-Visual Means ("OAVM") on Thursday, September 25, 2025 at 12:30 P.M (IST) in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India("SEBI") to transact the business set out in the Notice calling the AGM.

The Notice of the AGM alongwith the Annual Report will be sent electronically only to those Members of the Company, whose email address is registered with the Company/Registrar and Share Transfer Agent/Depository Participant(s)/Depositories. The Notice of the AGM and the aforesaid documents will also be available on the Company's website at www.gravisshospitality.com, the website of the Stock Exchange i.e. BSE Limited ("BSE") at www.bseindia.com and on the website of Registrar and Transfer Agent of the Company e. website of MUFG Intime India Private Limited (formerly Link Intime India Private Limited) i.e

https://instavote.linkintime.co.in/ Manner of casting vote(s) through e-voting:

https://web.in.mpms.mufg.com/KYC-downloads.html

Members can cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting"). The manner of voting, including voting remotely ("remote e-voting") by the Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their e-mail address has been provided in the Notice of the AGM. Members attending the AGM who have not cast vote(s) by remote e-voting will be able to vote electronically at the AGM. Instructions for updation of email address:

(a) The Shareholders holding shares in physical folios are requested to take note that SEBI, vide its circular dated March 16, 2023 (now rescinded due to issuance of Master Circular dated May 17, 2023) has mandated that with effect from April 1, 2024, dividend to Shareholders shall be paid only through electronic mode. Such payment shall be made only after furnishing the PAN, choice of nomination, contact details including mobile number, bank account details and specimen signature to RTA of the Company. Physical Holding Register/update the details in prescribed Form ISR-1 and other relevant forms with RTA available at

(b) Members holding share(s) in dematerialized mode, who have not registered/updated their e-mail ID with their Depository Participant(s) are requested to register/update the same with their Depository

Participant(s), where they maintain their demat accounts. SEBI vide Circular dated November 17, 2023 has done away with the provision regarding freezing of folios not having PAN, KYC and nomination details to mitigate unintended challenges on account of freezing of By Order of the Board of Directors,

Place : Mumbai Date : August 30, 2025

Romil Ratra CEO and Whole Time Director (DIN: 06948396)

For Graviss Hospitality Limited



J. KUMAR INFRAPROJECTS LIMITED

CIN: L74210MH1999PLC122886 Regd Off: J. Kumar House, CTS No. 448, 448/1, 449, Subhash Road, Vile Parle (East), Mumbai 400 057, Maharashtra, India Phone: +91 22 67743555, Fax: +91 22 26730814,

Email: investor.grievances@jkumar.com Website: www.jkumar.com

NOTICE OF 26™ ANNUAL GENERAL MEETING (AGM)

Notice is hereby given that the 26th AGM of J. Kumar Infraprojects Limited ('the Company') will be held on Tuesday, September 23, 2025 at 11:00 a.m. (I.S.T) at Vaishnavi Banquets, Gokul Arkade Building, Opp. Garware Chowk, Next to RBL bank, Vile Parle (E), Mumbai-400 057, Maharashtra.

- In compliance with the applicable laws, the Notice of the 26" AGM along with the Annual Report for year the financial year (FY) 2024-25 has been sent on Friday, August 29, 2025 only through electronic mode to those Members whose e-mail IDs are registered with the Company, Registrar & Share Transfer Agent (RTA) or the Depository Participant(s) (DP). Additionally, a letter is also sent to shareholders, whose e-mail IDs are not registered with Company/RTA/DP, providing the weblink of the Company's website from where the Annual Report for FY 2024-25 can be accessed.
- In compliance with the provisions of Section 108 of the Companies Act, 2023 read with Rule 20 of the Companies (Management and Administration) Rules 2014, as amended from time-to-time and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, and Secretarial Standard-2 as issued by the Institute of the Company Secretaries of India, the members are provided with the facility to caste their vote remotely to all resolutions set-forth in the notice, through electronic e-voting platform provided by National Securities Depository Limited ("NSDL") (remote e-voting)
- The remote e-voting period commences on September 20, 2025 (9:00 am) and ends on September 22, 2025 (5:00 pm). The remote e-voting module shall be disabled and members will not be allowed to vote after the aforesaid end date and time for e-voting and once the vote on resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.
- A person whose name is recorded in the register of members or in the register of beneficial owner maintained by the depositories as on the cut-off date i.e. Tuesday, September 16, 2025, only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting at AGM. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend/participate in
- available electronically for inspection by the Members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an email to investor.grievances@jkumar.com The Register of Members and share transfer books of the Company will remain closed from Wednesday, September 17, 2025 to Tuesday, September 23, 2025 (both days inclusive) for the purpose of the

the AGM shall not be entitled to cast their vote again. The documents referred to in the Notice of AGM are

- 26" AGM of the Company. The Record Date for the purpose of payment of final dividend for financial year ended March 31, 2025 shall be September 16, 2025. Any person who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the notice of Annual General Meeting and holding shares as on the cut-off date i.e. September 16, 2025
- may obtain the user ID and password by sending a request at helpdesk.evoting@nsdl.com The notice of AGM and the Annual Report are also available on the Company's website at www.jkumar.com and the same can also be accessed from the websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and the Notice will also be available on the website of the NSDL viz.www.evoting.nsdl.com.

Shareholders who have not yet registered their email addresses may obtain login credentials for e-voting by following the below mentioned process:

In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account Statement, PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) to evoting@nsdl.com or secretarial@jkumar.com or investor@bigshareonline.com

In case of any queries, you may refer the Frequently Asked Questions for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on: 022 - 4886 7000 or send a request to Ms. Pallavi Mhatre, Senior Manager at evoting@nsdl.com

For J. Kumar Infraprojects Limited

Date : August 29, 2025 Place: Mumbai

Poornima Chintakindi Company Secretary

SUZLON ENERGY LIMITED

[CIN: L40100GJ1995PLC025447] Regd. Office: "Suzlon", 5, Shrimali Society,

Website: www.suzlon.com; Email id: investors@suzlon.com

Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad-380009;

Tel.: +91.79.6604 5000;

SUZLON

NOTICE OF THIRTIETH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Thirtieth Annual General Meeting (the "AGM" or the "Meeting") of Suzlon Energy Limited (the "Company") will be held on Thursday, 25" September 2025 at 11.00 a.m. (IST) through Video Conferencing / Other Audio Visual Means ("VC / OAVM") in compliance with the Companies Act, 2013 read with General Circular No.09/2024 dated 19" September 2024 read with Circular No.14/2020 dated 8" April 2020, Circular No.17/2020 dated 13" April 2020, Circular No.20/2020 dated 5" May 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No.SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 3° October 2024 issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars") (MCA Circulars and SEBI Circular are hereinafter collectively referred to as the "Circulars") to transact the business as set out in the Notice of the AGM dated 12" August 2025 (the "AGM Notice"). KFin Technologies Limited, Selenium Tower B, Plot 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Hyderabad-500032, Telangana, India, Email: einward.ris@kfintech.com, Toll Free No.1-800-309-4001, the Company's Registrar and Share Transfer Agents ("KFin" or the "RTA"), will provide the facility for voting through remote e-voting, participating the Meeting through VC / OAVM and e-voting during the Meeting.

NOTICE is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and Rules made thereunder read with Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations") that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Friday, 19" September 2025 to Thursday, 25" September 2025 (both days inclusive) for the purpose of the AGM.

The Company has, on 29" August 2025, sent the AGM Notice along with the Annual Report containing Audited Financial Statements for the financial year ended 31" March 2025 on standalone and consolidated basis and the Reports of the Auditors and the Directors (together with annexures thereto) by email to all its shareholders who have registered their email addresses with the Company / RTA or Depositories. In compliance with the requirements of the Circulars, physical copy of the same is not being sent to the shareholders. Further, in terms of Regulation 36(1)(b) of the Listing Regulations, a letter providing the web-link and exact path for accessing the AGM Notice and the Annual Report has been sent to those shareholders who have not registered their email address(es).

The Annual Report along with the AGM Notice and E-voting instructions is also available on the website of the Company (www.suzlon.com), the weblink of KFin (https://evoting.kfintech.com) and also on the website of the National Stock Exchange of India Limited (www.nseindia.com) and the BSE Limited (www.bseindia.com). Since the Meeting is being held through VC / OAVM pursuant to the Circulars, physical attendance of the shareholders is dispensed with and consequently the facility for the appointment of the proxies is not applicable.

All the documents required to be kept open for inspection, if any, shall be open for inspection at the Registered Office and Corporate Office of the Company between 2.00 p.m. and 5.00 p.m. on all working days (except Saturdays, Sundays and Holidays). Such documents shall also be made available on the website of the Company (www.suzlon.com) to facilitate online inspection till the conclusion of the Meeting.

The procedure for registering email address, remote e-voting, attending the Meeting through VC / OAVM, and e-voting during the Meeting is given below:

A. Instructions for Members who have not registered their email address:

- Shareholders holding shares in physical mode are hereby notified that based on SEBI Circular number SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 dated 16" March 2023, all holders of physical securities in listed companies shall register the postal address with PIN for their corresponding folio numbers. It shall be mandatory for the security holders to provide mobile number. Moreover, to avail online services, the security holders can register e-mail ID. Shareholders can register / update the contact details by submitting the requisite Form ISR 1 along with the supporting documents. Form ISR 1 can be obtained by following the link: https://ris.kfintech.com/clientservices/isc/isrforms.aspx. Form ISR 1 and the supporting documents can be provided by any one of the following modes.
 - Through 'In Person Verification' (IPV): the authorised person of KFin shall verify the original documents furnished by the shareholder and retain copy(ies) with IPV stamping with date and initials; or
 - Through hard copies which are self-attested, which can be sent to KFin at Selenium Building, Tower-B, Plot No 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad, Rangareddy, Telangana India - 500 032; or
 - Through electronic mode with e-sign by following the link: https://ris.kfintech.com/clientservices/isc/default.aspx#.
- Detailed FAQs are available on KFin's weblink https://ris.kfintech.com/faq.html.
- Shareholders holding shares in electronic mode may reach out to the respective Depository Participant(s) ("DP"), where the demat account is being held for updating the email IDs and mobile number.
- B. Cut-off Date and instructions for obtaining User ID and Password for person who acquire shares after cut-off date.
 - The cut-off date for the purpose of ascertaining shareholders entitled for remote e-voting and voting at the Meeting is Thursday, 18" September 2025 (hereinafter referred to as the "Cut-off Date"). A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off Date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the Meeting. A person who is not a shareholder as on the Cut-off Date should treat this Notice for information purpose only.
 - Any person, who acquires shares of the Company and becomes a member of the Company after the despatch of the AGM Notice and is holding shares as on the Cut-off date, may obtain the User ID and Password in the manner as mentioned below:
 - If the mobile number of the member is registered against Folio No. / DP ID Client ID, the member may send SMS: MYEPWD<space>E-voting Event Number (EVEN) + Folio No. or DP ID Client ID to +91 9212993399

Example for NSDL: MYEPWD<SPACE>IN12345612345678

Example for CDSL: MYEPWD<SPACE> 1402345612345678 Example for Physical: MYEPWD<SPACE> 90711234567890

- If email ID of the member is registered against Folio No. / DP ID Client ID, then on the home page of https://evoting.kfintech.com, the member may click 'Forgot password' and enter Folio No. or DP ID Client ID and PAN to generate a password.
- Members may send an email request to evoting@kfintech.com. If the member is already registered with the KFin e-voting platform, then such member can use his / her existing User ID and password for casting the vote through remote e-voting.
- Members may call KFin toll free number 1-800-309-4001 for any clarifications / assistance that may be required.

C. Instructions pertaining to remote e-voting:

In compliance with the provisions of Section 108 of the Act, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the Listing Regulations read with SEBI circular no.SEBI/HO/CFD/CMD/CIR/P/2020/242 dated 9" December 2020 relating to 'e-voting Facility Provided by Listed Entities' ("SEBI e-voting Circular"), the Company is providing the facility to the shareholders to exercise their right to vote on the proposed resolutions electronically ("remote e-voting"). KFin will provide the remote e-voting facility to enable the shareholders to exercise their right to vote on resolutions proposed to be considered through this Notice by electronic means. Remote e-voting is optional. The following information is being provided to the members in respect of remote e-voting:

- Members may cast their votes on all resolutions set out in the AGM Notice using an electronic voting system from a place other than the venue of the Meeting ("remote e-voting").
- The remote e-voting period commences on Monday, 22" September 2025 (9.00 a.m. IST) and ends on Wednesday, 24" September 2025 (5.00 p.m. IST). During this period, the shareholders of the Company holding fully paid-up shares either in physical form or in demat form, as on the Cut-off Date may cast their vote by remote e-voting. The remote e-voting module shall be disabled by KFin for voting thereafter. Once the vote on a resolution is cast by a member, whether partially or otherwise, the member shall not be allowed to change it subsequently or cast the vote again. Members, who cast their vote by remote evoting, may attend the Meeting through VC / OAVM, but will not be entitled to cast their vote once again on the resolutions.
- In terms of SEBI e-voting Circular, e-voting process has been enabled for all 'individual demat account holders', by way of a single login credential, through their demat accounts / websites of Depositories / DP.
- The detailed instructions for remote e-voting are given in the AGM Notice available on the website of the Company (www.suzlon.com), the weblink of KFin (https://evoting.kfintech.com) and also on the website of the National Stock Exchange of India Limited (www.nseindia.com) and the BSE Limited (www.bseindia.com).

D. Instructions pertaining to joining the Meeting through VC / OAVM and for voting at the Meeting:

- Members will be able to attend the Meeting through VC / OAVM or view the live webcast of the Meeting at https://emeetings.kfintech.com/ by using their remote e-voting login credentials and selecting the "EVEN" for the Company's Meeting.
- Members who do not have the User ID and Password for e-voting or have forgotten the User ID and Password may retrieve the same by following the instructions mentioned in the AGM Notice. Further, members can also use the OTP based login for logging into the e-voting system.
- Facility of joining the Meeting through VC / OAVM shall open 30 (thirty) minutes before the time scheduled for the Meeting and shall be kept open throughout the Meeting. Members will be able to participate in the Meeting through VC / OAVM on a first-come-first-serve basis. Up to 1,000 shareholders will be able to join the Meeting on a first-come-first-serve basis.
- iv. Members, holding shares as on the Cut-off Date and who would like to speak or express their views or ask questions during the Meeting may register themselves as speakers at https://emeetings.kfintech.com and clicking on "Speaker Registration" during the period from Monday, 22" September 2025 (9.00 a.m. IST) up to Wednesday, 24" September 2025 (5.00 p.m. IST). Those members who have registered themselves as a speaker will only be allowed to speak / express their views / ask questions during the Meeting. The Company reserves the right to restrict the number of questions and number of speakers, as appropriate for smooth conduct of the Meeting. Alternatively, members holding shares as on the Cut-off Date may also visit https://emeetings.kfintech.com and click on the tab 'Post Your Queries' and post their queries / views / questions in the window provided, by mentioning their name, demat account number / folio number, email ID and mobile number. The window will close at 5.00 p.m. (IST) on Wednesday, 24" September 2025. The shareholders may also send their questions by email to investors@suzlon.com.
- v. The procedure for e-voting during the Meeting is same as the procedure for remote e-voting since the Meeting is being held through VC / OAVM. The e-voting window shall be activated upon instructions of the Chairman of the Meeting during the Meeting. E-voting during the Meeting is integrated with the VC / OAVM platform and no separate login is required for the same. The detailed procedure for remote e-voting, attending the Meeting through VC / OAVM and voting at the Meeting has been provided in the AGM Notice.

Mr. DSM Ram, Practicing Company Secretary, has been appointed as Scrutinizer to scrutinize the remote e-voting process and e-voting at the Meeting in a fair and transparent manner.

In case of any query and / or assistance required, relating to remote e-voting, attending the Meeting through VC / OAVM mode and e-voting during the Meeting, members may refer to the Help & Frequently Asked Questions (FAQs) and 'AGM VC / OAVM' user manual available at the download Section of https://evoting.kfintech.com or contact Mr. Dnyanesh Gharote, Vice President, KFin, at the email ID evoting@kfintech.com or KFin's toll free No.: 1-800-309-4001.

> For Suzlon Energy Limited Geetanjali S.Vaidya,


> > Company Secretary.

29" August 2025

epaper.financialexpress.com

Ahmedabad





બ્રાન્ચ ઓફિસ: એક્સિસ બેન્ક લિમિટેડ, કલેક્શન સેન્ટર, ફર્સ્ટ ફ્લોર, યુનિટ નં.૧૦૧ અને ૧૦૨ (પાર્ટ) બલેશ્વર એવેન્યુ એસ જી હાઇવે સામે રાજપથ કલબ બોડકરેવ અમદાવાદ ગુજરાત - ૩૮૦ ૦૫૪. AXIS BANK **કોર્પોરેટ ઓફિસ**ઃ એક્સિસ્ બેન્ક લિમિટેડ, ત્રીજો માળ, ગીગાપ્લેક્સ, એનપીસી – ૧, ટીટીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મુગલસન રોડ, એરોલી, નવી મુંબઈ – ૪૦૦ ૭૦૮.

કબજા નોટીસ પરિશિષ્ટ –IV [નિયમ ૮(૧)]

નીચે સહી કરનાર, **એકિસસ બેંક લિ**. ના અધિકૃત અધિકારી તરીકે સિક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટ ઈન્ટરેસ્ટ એકટ - ૨૦૦૨ (ઉક્ત અધિનિયમ) હેઠળ તેમજ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ - ૨૦૦૨ (ઉકન અધિનિયમ) ના સેક્શન ૧૩(૧૨) સાથે નિયમ ૩ વચાણ લેતાં મળેલ સત્તાની રૂએ નીચે ટેબલમાં જણાવેલ તારીએ ડીમાન્ડ નોટીસ જારી કરેલ હતી નીચે ટેબલમાં જણાવેલ કરજદાર/સહ-કરજદાર/ગીરવેદાર/ જામીનદાર નીસ વેતાં મળેલ સત્તાની રૂએ નીચે ટેબલમાં જણાવેલ તારીખે ડીમાન્ડ નોટીસ જારી કરેલ હતી. નીચે ટેબલમાં જણાવેલ કરજદાર/સહ-કરજદાર/ગીરવંદાર/ જામીનદાર નીચે ટેબલમાં જણાવેલ કરજદાર/સહ-કરજદાર/ગીરવંદાર/ જામીનદાર નીચે ટેબલમાં જણાવેલ કરજદાર/સહ-કરજદાર/સહ-કરજદાર/જામીનદારની તારીખથી દિન દુખમાં ભરાયાઈ કરી જવા જણાવેલ, નીચે ટેબલમાં જણાવેલ કરજદાર/સહ-કરજદાર/જામીનદારને સિક્યુરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફ્રોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટરેસ્ટ એકટ - ૨૦૦૨ હેઠળ આપેલી નોટીસમાં જણાવેલ બેંકની બાકી રકમની ચુકવણી કરવામાં કસુરવાર નીવડયા છે. તેથી અને આ દેણદાર અને નોટીસમાં ઉલ્લેખલ અત્યોને ખાસ તથા જાહેર જનતાને સામાન્ય રૂપે નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે તેને ઉપરોક્ત કાયદાના સેકશન ૧૩(૪) સાથેનિયમાં પૈકી નિયમ ૮ વંચાણે લેતા મળેલ સત્તાની રૂએ નીચે જણાવેલ તારીખે નીચે વર્ણવેલ મિલકતનો કબજો લીધો છે. અત્રે નીચે ટેબલમાં ઉલ્લેખ કરેલ કરજદાર/સહ-કરજદાર/જામીનદારને વિશેષ રૂપે અને સામાન્ય રીતે જાહેર જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે સદરહુ મિલકત અંગે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહી અને તે રીતે થયેલ કોઈપણ વ્યવહાર તે નોટીસમાં જણાવ્યા મુજબ એકિસસ બેંક લિ. નીચે ટેબલમાં જણાવ્યા મુજબની બાકી સ્કમ ઉપરાંત આ રક્ષ પરનું કોન્ટ્રસ્થુઅલ દરે થતું આગળનું વ્યાજ, થયેલ | થનારા આકસ્મિક ખર્ચા, પડતર, ચાલુંસ વગેરે રકમમાં બોજા આધીન રહેશે. ગીરવે રાખેલ અસ્ક્રયામતો આપેલા મામ્યામાં ભેડાવવા અંગે રસ્ત્રમાં આવે છે કે અલ્લા કોઈ પણ વ્યવહાર તે નોટીસમાન વચાન સ્વત્ર કરામાં બોજી આધીન રહેશે. ગીરવે રાખેલ અસ્ક્રયામતો આપેલ મોર્ચમાં ભેડાવવા અંગે રસ્ત્રમાં આવે છે. નાપેલા સમયમાં છોડાવવા અંગે કરજદારોનું સરફેસી એકટ - ૨૦૦૨ ના સેક્શન ૧૩ના સબ સેક્શન ૮ ની જોગવાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

કરજદાર/	ડિમાન્ડ નોટીસ તારીખ	મિલકતોની વિગતો	કબજાની
જમીનદારો/ સહ-	અને બાકી રકમ (વ્યાજ		તારીખ અને
કરજદારનું નામ	+ ચાર્જીસ-રીકવરી)		પ્રકાર
(1) દિપક મહેશભાઈ સોલંકી (2) જ્યોત્સના દિપકભાઈ સોલંકી	31.01.2025 & Rs. 13,86,570.00/-	મિલકત ફ્લેટ નંબર ૧૦૩, બ્લોક નંબર "S", પહેલો માળ, ૭૦ ચોરસ યાર્ડ્સનું માપન, એટલે કે પ૮.૫૧ ચોરસ મીટર, (૨૦.૧૪ ચોરસ મીટરની અવિભાજિત જમીન), "આકૃતિ બેવડી" તરીકે ઓળખાતી યોજનામાં, બિન-કૃષિ જમીન ધારણ સર્વે નંબર ૭૧/૫/૧, ૭૧/૫/૨, અને ૭૧/૫/૩, ટીપીએસ ૫૭ ના અંતિમ પ્લોટ નંબર ૮૧,૧૧૧, મૌજ - નારોલ, તા. મણિનગર, અમદાવાદ નોંધણી સબ ડિસ્ટ્રેક્ટ અમદાવાદ - ૫ (નારોલ) જિલ્લામાં સ્થિત છે. સીમાઓ : પૂર્વ :- ફ્લેટ નંબર S-૧૦૨, પશ્ચિમ :- બ્લોક R, ઉત્તર :- ફ્લેટ નંબર S-૧૦૪, દક્ષિણ :- ૨૦ ફૂટ રોડ.	27-08-2025 (Physical)

કૃપા કરીને એ બાબતની વધુ નોંધ લેશો કે ઉપરોક્ત કાયદાની કલમ 13 ની પેટા કલમ 13માં ઉલ્લેખ કર્યા મુજબ, તમે અમારી બેંકની આગોતરી લેખિત સંમતિ વિના . ખા નોટિસમાં ઉલ્લેખિત જામીનગીરી હેઠળ જણાવેલી કોઈ પણ અસ્ક્યામતોના વેચાણ, ભાડાપટ્ટા અથવા અન્ય કોઈ પણ રીતે તબદિલી કરી શકશો નહિ.

Chola ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ : ચોલા ક્રેસ્ટ, સુપર બી, સીપ૪ અને સીપપ, ૪, થીરૂ વી કા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગિન્ડી, ચેન્નાઈ ૬૦૦૦૩ર પરિશિષ્ટ ૪ જુઓ નિયમ ૮(૧)] કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી **ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ**ના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરનાર, ધી સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ના ૫૪) અને સેક્શન ૧૩(૧૨)ને ધી સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતાં હેઠળ મળેલ સત્તાની રૂએ દેણદાર ને એક ડિમાન્ડ નોટિસ મોકલી હતી નોટિસમાં જણાવેલ રકમ અને તેના પરનું વ્યાજ ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવેલ. દેણદાર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલ છે, જેથી દેણદારો અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે નીચે વર્ણવેલ મિલકતોનો નીચે સહી કરનારે તેને મળેલ સદર કાયદાના સેક્શનના સબ-સેક્શન (૪) સેક્શન ૧૩ ને ધ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ **ભૉતિક કબજો** લીધો છે. દેણદારને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે સૂચિમાં જણાવેલ મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ સોદા ધિરાણ અને તેના પરના વ્યાજ સાથે **મેસર્સ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ**ના ચાર્જમાં ગણાશે. સિક્ચોર્ડ અસ્ક્ચામતો છોડાવવાની ઉપલબ્ધતા સમયમર્યાદા અંગે સરફેસી કાયદાના સેક્શન ૧ ૩ના સબ-સેક્શન (૮) તરફ દેણદારનું ધ્યાન દોરવામાં આવે છે.

			. , ,	
દેશદારનું નામ અને સરનામું અને લોન એકાઉન્ટ નં.	કીમાન્ડ નોટીસની તારીખ	બાકી રકમ	કબજાવાળી મિલકતનું વર્ણન	વારીખ કબજાની
લોન એકાઉન્ટ નં. HL29AJR000126285 શ્રી રમીઝભાઇ મુસ્તાકભાઇ જાદવ (ઉર્ફે) રમીઝભાઇ જાદવ, શ્રીમતી જાદવ અફસાનાબાનુ રમીઝભાઇ (ઉર્ફે) જાદવ રમીઝભાઇ બંને રહે: અનમોલ પેલેસ, ભોમેશ્વર વાડી, બ્લોક નં. ૪, સ્ટીલ નં. ૨, જામનગર રોડ, સન એવન્યુ એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ, રાજકોટ, ગુજરાત, ૩૬૦૦૦૬, સન એવન્યુ નજીક, રાજકોટ, ગુજરાત-૩૬૦૦૦૬ અહીં પણ: ફલેટ નંબર ૨, બીજો માળ, ભોમેશ્વર વાડી, શેરી નં ૨, ભોમેશ્વર રેલવે કોસિંગ પાસે, જામનગર હાઇવેની બહાર, રાજકોટ, ગુજરાત, ૩૬૦૦૦૧	h202-50-Eb	રૂા. ૨૧૫૪૭૨૨/- (અંકે રૂપિયા એકવીસ લાખ ચોપ્પન હજાર સાતસોબાવીસ પુરા) તારીખ ૧૧-૦૬-૨૦૨૫ મુજબ	નં. ૪૯૩ પૈકી રાજકોટ સિટી સર્વે વોર્ડ નં. ૧ દ/૧ સિટી સર્વે નં. ૧૯૫૯, રાજકોટ સીટી તાલુકોઃ રાજકોટ અને જિલ્લોઃ રાજકોટ ખાતે સ્થિત છે. ચતુર્સીમાઓઃ -ઉત્તરઃ - આ બાજુ અન્યનું ઘર, દક્ષિણઃ- આ બાજુ મુખ્ય દરવાજો, સામાન્ય રોડ, સીડી અને લિફ્ટ, પૂર્વઃ - આ બાજુ પાર્કિંગની જગ્યા, ફ્લેટની કમ્પાઉન્ડ વોલ પછી રોડ, પશ્ચિમઃ- આ બાજુ માર્જિનની જગ્યા, ફ્લેટની કમ્પાઉન્ડ દિવાલ પછી અન્યનું ઘર.	გათ ა გათ-20-გა
તા. : ૨૫-૦૮-૨૦૨૫	અધિકૃત અધિકારી,			

મેસર્સ ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ

મહાલક્ષ્મી રબટેક લીમીટેડ

સીઆઇએન:- L25190GJ1991PLC016327 **રજીસ્ટર્ડ ઓફીસઃ-** ''મહાલક્ષ્મી હાઉસ'', વાયએસએલ એવન્યુ, કેતવ પેટ્રોલ પંપ સામે, પોલિટેકનીક રોડ, આંબાવાડી, અમદાવાદ, ગુજરાત-૩૮૦ ૦૧ પ. વેબસાઇટઃ- <u>www.mrtglobal.com,</u> ટેલીફોનઃ- ૦૭૯ - ૪૦૦૦૮૦૦૦, ઇ-મેઇલ આઇડોઃ- <u>cs@mahalaxmigroup.net</u>

વિડીયો કોન્ફરન્સિંગ ("વીસી") / અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો ("ઓએવીએમ") હારા ચોજાનાર **૩૪મી વાર્ષિક સાધારણ સભાને લગ**તી માહિતી

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીના શેરધારકોની ૩૪મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) કંપની ધારા,૨૦૧૩ની તમામ લાગુ પડતી જોગવાઈઓ અને તે હેઠળ રચેલા નિયમો અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ("એમસીએ'') દ્વારા જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તારીખ પમી મે ૨૦૨૦ અને સામાન્ય પરિપત્ર નં. ૦૯/૨૦૨૩ તારીખ ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના અને સિક્યોરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા ("સેબી") દ્વારા જારી કરાયેલા પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨ મે, ૨૦૨૦, પરિપત્ર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તા.૭મી ઓકટોબર, ૨૦૨૩ અને SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 તા.૧૩ ઓકટોબર, ૨૦૨૪, (અહીં સંયુક્ત રીતે 'પરિપત્રો' તરીકે વર્ણવેલ છે)ના પાલન હેઠળ ૩૪મી એજીએમની નોટિસમાં જણાવેલા વ્યવસાયો પર કામકાજ માટે શનિવાર તારીખ ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે દ્વિ-માર્ગીય વિડીયો કોન્ફરન્સિંગ (''વીસી'') / અન્ય ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમો (''ઓએવીએમ'') સવલત દ્વારા યોજાશે.

પરિપત્રોનું પાલન કરીને ૩૪મી એજીએમની નોટિસ તેમજ નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૦૨૫નો વાર્ષિક અહેવાલ જે સભ્યોનાં ઈમેઈલ એડ્રેસ કંપની / નેશનલ સિક્યોરીટીઝ લીમીટેડ / સેન્ટ્લ ડીપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડીયા) લીમીટેડ (''ડીપોઝીટરીઝ'') પાસે રજીસ્ટર્ડ છે તેમને ઇલેક્ટ્રનિક માધ્યમથી મોકલવામાં આવશે. ૩૪મી એજીએમની નોટિસ તેમજ નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૦૨૫નો વાર્ષિક અહેવાલની નકલ કંપનીની વેબસાઇટ <u>www.mrtglobal.com</u> પર, અનુક્રમે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડીયાની વેબસાઇટ <u>www.bseindia.com</u>, અને <u>www.nseindia.com</u>, અને એમયુએફજી ઇન ટાઇમ ઇન્ડીયા પ્રા.લિ. (MIPL) ની વેબસાઇટ <u>https://instavote.linkintime.co.in</u> પર ઉપલબ્ધ રહેશે. રિમોટ ઇ-વોર્ટિંગ મારફત વોટિંગ, વીસી / ઓએવીએમમાં ભાગ લેવા માટે અને એજીએમ દરમ્યાન ઇ-વોટિંગની સવલત પુરી પાડવા માટે કંપની એ એમયુએફજી ઇન ટાઇમ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ (''એમઆઇઆઇપીએલ'')ની સેવાઓ રોકેલ છે.

ઈમેઈલ આઇડી રજીસ્ટર/અપડેટ કરવાની રીત :

સ્થળ : રાજકોટ

- જે સભ્યોના ઈમેઈલ આઇડી કંપની / ડીપોઝીટરીઝ પાસે પહેલેથી જ નોંધાયેલા છે તેઓને ઇ-વોટિંગ માટેની લોગીન માહિતી તેમના રજીસ્ટર્ડ ઈમેઈલ એડ્રેસ પર મોકલવામાં આવશે.
- 🔹 જે સભ્યો ફીઝીકલ સ્વરૂપે શેર્સ ધરાવતા હોય અને તેઓએ ઈ-મેઈલ એડ્રેસ કંપની / ડીપોઝીટરીઓ પાસે નોંધાવેલા નથી, તેઓએ ફોલિયો નંબર અને શેરહોલ્ડરનું નામ (યુનિટ : મહાલક્ષ્મી રબટેક લીમીટેડ), પાંચમો માળ, પ૦૬ થી પ૦૮, અમરનાથ બીઝનેસ સેન્ટર-૧ (એબીસી-૧), ગાલાબિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટઝેવીયર્સ કોલેજ કોર્નર પાસે, ઓફ સી.જી.રોડ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯-૨૬૪૬૫૧૭૯, ઇ-મેઇલ આઇડી : ahmedabad@linkintime.co.in પર સહી કરેલ વિનંતીપત્ર એમઆઇઆઇપીએલ ને મોકલાવીને નોંધાવી શકે છે.
- ડીમેટ સ્વરૂપે શેર ધરાવતા કિસ્સામાં, સભ્યો ડીપોઝીટરી પાર્ટિસીપન્ટ(ડીપી) નો સંપર્ક કરીને ડીપી ની સલાહ મુજબ પ્રક્રિયા અનસરીને ડીમેટ એકાઉન્ટમાં ઈમેઈલ એડ્રેસ રજીસ્ટર કરાવી શકે છે.

એજીએમ દરમ્યાન વોટિંગ કરવાની રીત :

સભ્યોને ઇલેક્ટ્રોનિક વોટિંગ સીસ્ટમથી ૩૪મી એજીએમ ની નોટિસમાં જણાવેલ કામકાજ પર રિમોટ પધ્ધત્તિથી અથવા એજીએમ દરમ્યાન તેમના વોટ આપવાની તક મળશે. ડીમટીરીયલાઇઝ સ્વરૂપે, ફીઝીકલ સ્વરૂપે શેર ધરાવતા સભ્યો અને જેમણે ઈમેઈલ એડ્રેસ રજીસ્ટર કરાવ્યા નથી તેવા સભ્યો માટે રિમોટ રીતે અથવા એજીએમ દરમ્યાન વોટ આપવાની રીત ૩૪મી એજીએમની નોટિસમા પુરી પાડવામાં આવશે.

ઉપરોક્ત માહિતી પરિપત્રોના પાલન હેઠળ કંપનીનાં તમામ સભ્યશ્રીઓની જાણકારી અને લાભાર્થે જારી કરાઇ છે.

આ માહિતી કંપનીની વેબસાઇટ <u>www.mrtglobal.com.</u>પર, અનુક્રમે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડીયા ની વેબસાઇટ <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> પણ ઉપલબ્ધ છે.

સભ્યો, ફોલિયો નંબર / ડીપી આઇડી અને ક્લાયન્ટ આઇડી જણાવીને, કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટનો સંપર્ક કરી શકે છે : એમચુએફ્જી ઇન ટાઇમ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ

(યુનિટઃ મહાલક્ષ્મી રબટેક લીમીટેડ), પાંચમો માળ, પ૦૬ થી પ૦૮, અમરનાથ બીઝનેસ સેન્ટર-૧(એબીસી-૧), ગાલાબિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટઝેવીયર્સ કોલેજ કોર્નર પાસે, સી.જી.રોડ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૯. ફોન : ૦૭૯-૨૬૪૬૫૧૭૯, ઇ-મેઇલ આઇડી: <u>ahmedabad@linkintime.co.in</u>

બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી ાહાલક્ષ્મી રબટેક લીમીટેડ વર્તી કલ્પના કુમારી

તારીખઃ ઓગસ્ટ ૩૦, ૨૦૨૫ આઇસીએસઆઇ મેમ્બરશીપ નં.: A51657 સ્થળઃ અમદાવાદ

સૂઝલોન એનર્જી લીમીટેડ

ાસીં આઈએન: એલ૪૦૧૦૦જીજે૧૯૯૫પીએલસી૦૨૫૪૪૭] રજિસ્ટર્ડ ઓફીસ: "સૂઝલોન", પ, શ્રીમાળી સોસાયટી, શ્રી ક્રિષ્ના કોમ્પ્લેક્ષની પાસે,

નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૯; ટેલી: +૯૧-૭૯-૬૬૦૪૫૦૦૦

વેબસાઇટ: www.suzlon.com; ઇ-મેઈલ આઈડી: investors@suzlon.com



૩૦મી વાર્ષિક સામાન્ય સભા, બુક ક્લોઝર અને ઇ-વોટિંગની માહિતી અંગેની નોટિસ

આથી સૂચના આપવામાં આવે છે કે તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ની એજીએમ નોટિસ ("એજીએમ નોટિસ") માં નક્કી કર્યા મુજબ વેપારના વ્યવહારો માટે સૂઝલોન એનર્જી લીમીટેડ (કંપની) ની ૩૦મી વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ" અથવા "સભા"), કંપની અધિનિયમ, ૨૦૧૩ અને કોર્પોરેટ બાંબતોના મંત્રાલય ઘ્વારા ઇસ્યુ કરવામાં આવેલ તાં. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ ના પરિપત્ર કમાંક ૦૯/૨૦૨૪, તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના પરિપત્ર કમાંક ૦૯/૨૦૨૩, તા. ૮ એપ્રિલ ૨૦૨૦ ના પરિપત્ર કમાંક ૧૪/૨૦૨૦, તા. ૧૩ એપ્રિલ ૨૦૨૦ ના પરિપત્ર કમાંક ૧૭/૨૦૨૦, તા. ૫ મે ૨૦૨૦ ના પરિપત્ર ક્રમાંક ૨૦/૨૦૨૦, તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક ૦૨/૨૦૨૧, તા. ૮ ડિસેમ્બર ૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક ૧૯/૨૦૨૧, તા. ૫ મે ૨૦૨૨ ના પરિપત્ર ક્રમાંક ૦૨/૨૦૨૨ અને તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ ના પરિપત્ર ક્રમાંક ૧૦/૨૦૨૨ ("એમસીએ પરિપત્રો"), અને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સયેંજ બોર્ડના તા. ૩ ઓક્ટોબર ૨૦૨૪ ના પરિપત્ર ક્રમાંક No.SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 ("સેબી પરિપત્રો"), (સામૂહિક રીતે "પરિપત્રો"), સાથે વાંયતાં, ગુરુવાર, તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે (ભારતીય સમય પ્રમાણે) વિડીયો કોન્ફરન્સિંગ / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (વીસી / ઓએવીએમ) દ્વારા યોજાશે. કેફિન ટેકનોલોજીસ લીમીટેડ ("કેફિન" અથવા "આરટીએ"), સેલેનિયમ, ટાવર બી, પ્લોટ ૩૧ અને ૩૨, ફાયનાન્સીયલ ડિસ્ટ્રીકટ, નાનકરોમગુડા, સેરિલિંગમપલ્લી મંડલ, હૈદ્રાબાદ-પ૦૦૦૩૨, તેલંગાણા, ભારત, ઇ-મેઇલ એડ્રેસ: einward.ris@kfintech.com, ટોલ-ફ્રી ફોન નંબર ૧-૮૦૦-૩૦૯-૪૦૦૧, રિમોટ ઇ-વોટિંગ, વીસી / ઓએવીએમ થી સભા માં ભાગ લેવા અને સભા દરમ્યાન રિમોટ ઈ-વોટિંગ ની સવલતો પુરી પાડશે.

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૯૧ અને તે હેઠળ બનાવવામાં આવેલા નિયમો અને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડના (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર આવશ્યકતાઓ) વિનિયમો ૨૦૧૫ (લિસ્ટિંગ રેગ્યુલેશન્સ), ના વિનિયમ ૪૨ સાથે વંચાણે લેતા, આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીના સભ્યોનું ૨જીસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક્સ શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ગુરુવાર, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ (બંને દિવસો સામેલ છે) સુધી એજીએમ ના હેતુ માટે બંધ રહેશે.

કંપનીએ ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ, એજીએમ ની નોટિસ સાથે, તા. ૩૧ માર્ય ૨૦૨૫ ના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષના એકલ (Standalone) અને સંકલિત (Consolidated) સ્વરુપે ઓડિટેડ નાણાકીય પત્રકો અને ઓડિટર્સ અને ડાયરેકટર્સના અહેવાલો (તેમના પત્રકો સાથે) સાથેનો વાર્ષિક અહેવાલ જે શેરધારકોએ, કંપની / આરટીએ અથવા ડિપોઝીટરી પાસે તેમના ઇ-મેઈલ એડ્રેસ નોધાવેલા છે તેમને ઇ-મેઈલ ધ્વારા મોકલી આપેલ છે. પરિપત્રોની જોગવાઇઓના અનુપાલનમાં, સભા માટે તેની ભૌતિક નકલ શેરધારકોને મોકલવામાં આવી રહી નથી. વધુમાં, લિસ્ટિંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૩૬(૧)(બી) ના સંદર્ભમાં, એજીએમ નોટિસ અને વાર્ષિક અહેવાલ મેળવવા માટે ની વેબલિક પ્રદાન કરતો પત્ર જે શેરધારકોએ તેમના ઇમેઇલ સરનામાં નોંધાવ્યા નથી તે શેરધારકોને મોકલવામાં આવ્યો છે.

એજીએમની નોટિસ અને ઇ-વોટીંગ માટેની સૂયનાઓ સાથેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ (www.suzlon.com) પર અને કેફિનની વેબલિક (https://evoting.kfintech.com) પર ઉપલબ્ધ છે. ઉપરાંત તે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લીમીટેડ (www.nseindia.com) અને બીએસઇ લીમીટેડ (www.bseindia.com) ની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

પરિપત્રોની જોગવાઇઓ અનુસાર સભા વીસી / ઓએવીએમ દ્વારા યોજવામાં આવતી હોવાથી, શેરધારકોની ભૌતિક હાજરીની આવશ્યકતા રહેતી નથી આથી સભા માટે શેરધારકો દ્વારા અવેજી વ્યક્તિની નિમણૂકની સુવિધા લાગુ પડશે નહીં.

નિરીક્ષણ માટે ખુલ્લા રાખવા જરૂરી હોય તે તમામ દસ્તાવેજો, તપાસ માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે અને કોર્પોરેટ ઑફિસે કામકાજના તમામ દિવસો દરમ્યાન (શનિવાર, રવિવાર અને રજાના દિવસો સિવાય) બપોરે ર.૦૦ કલાકથી સાંજે પ.૦૦ કલાક સુધી નિરીક્ષણ માટે ખુલ્લા રહેશે. સભા પૂર્ણ થાય ત્યાં સુધી આ દસ્તાવેજો, ઓનલાઇન નિરીક્ષણ માટે કંપનીની વેબસાઇટ (www.suzlon.com) પર પણ ઉપલબ્ધ થશે.

ઇ-મેઈલ એડ્રેસની નોધણી, રિમોટ ઇ-વોટીંગ, વીસી / ઓવીએએમ દ્વારા સભામાં ભાગ લેવા અને સભા દરમિયાન ઇ-વોટીંગ ની પધ્ધતિ નીચે જણાવેલ છે.

(એ) જેમણે પોતાના ઇ-મેઈલની નોધણી કરાવી નથી તેવા શેરધારકો માટેની સયનાઓ:

- તારીખ ૧૬ માર્ચ ૨૦૨૩ ના સેબી પરિપત્ર ન. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 પર આધારિત, ભૌતિક સ્વરુપ માં શેર ધરાવનારા શેરધારકોને આથી સૂચિત કરવામાં આવે છે કે વિસ્ટેડ કંપનીઓમાં ભૌતિક સ્વરુપ માં શેર ધરાવતા તમામ ધારકોએ તેમના અનુરુપ ફોલિયો નંબરો માટે પિન કોડ સાથે પોસ્ટલ સરનામું રજીસ્ટર કરવું જરુરી છે. શેરધારકોએ મોબાઈલ નંબર આપવો ફરજિયાત રહેશે. વધુમાં, ઓનલાઈન સેવાઓ મેળવવા માટે, શેરધારકો તેમના ઈમેલ આઈડીની નોંધણી કરાવી શકે છે. શેરધારકો જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ISR-1 જમા કરીને સંપર્ક વિગતોની નોંધણી / અપડેટ કરી શકે છે. ફોર્મ ISR-1 https://ris.kfintech.com/clientservices/isc/default.aspx લિંક પર ક્લિક કરીને મેળવી શકાય છે. ફોર્મ ISR-1 અને જરૂરી દસ્તાવેજો નીયેનામાંથી કોઈપણ એક દ્વારા પ્રદાન કરી શકાય છે:
 - 'ઈન પર્સન વેરિફિકેશન' (IPV) દ્વારા, કેફિન ના અધિકૃત વ્યક્તિ, શેરધારક દ્વારા પૂરા પાડવામાં આવેલ મૂળ દસ્તાવેજોની યકાસણી કરશે અને તારીખ અને આદ્યાક્ષરો, IPV સ્ટેમ્પિંગ સાથે ની કોપી / કોપીઓ જાળવી રાખશે;
 - સ્વ-પ્રમાણિત હાર્ડ કોપીઓ કેફિન ના સરનામા પર મોકલીને;
 - ઇ-સાઇન સાથે ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા https://ris.kfintech.com/clientservices/isc/default.aspx લિકને અનુસરીને.

વિગતવાર FAQs કેફિન ની વેબલિક https://ris.kfintech.com/faq.html પર ઉપલબ્ધ છે.

ઇલેક્ટ્રોનિક મોડમાં શેર ધરાવતા શેરધારકો, તેમના ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર અપડેટ કરવા, તેમના સંબંધિત ડિપોઝિટરી સહભાગી(ઓ) નો સંપર્ક કરી શકે છે.

(બી) કટ-ઓફ તારીખ અને કટ-ઓફ તારીખ પછી શેર મેળવનાર વ્યક્તિ માટે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા માટેની સૂચનાઓ.

- રિમોટ ઈ-વોર્ટિંગ અને સભામાં વોર્ટિંગ માટે હકદાર શેરધારકોની ખાતરી કરવાના હેતુ માટે કટ-ઑફ તારીખ ગુરુવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ ("કટ-ઑફ તારીખ") **રાખવામાં આવેલ છે.** કટ-ઓફ તારીખે, જે સભ્યોનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોર્ઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભદાયી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલ છે ફક્ત તે જ રિમોટ ઇ-વોર્ટીગ થી અને સભા દરમ્યાન મત આપવા હકદાર રહેશે. કટ-ઓફ તારીખે જે વ્યક્તિ શેરહોલ્ડર ન હોય તેવી વ્યક્તિએ આ નોટિસને માત્ર માહિતીના હેતુ માટે
- જે કોઈ વ્યક્તિ, એજીએમની નોટિસ મોકલ્યા બાદ કંપનીના શેર મેળવે છે અને કંપનીનો સભ્ય બને છે અને કટ-ઓફ તારીખે શેર ધારણ કરે છે, તે નીયે દર્શાવેલ રીતે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે:
 - જો ફોલીઓ નંબર/ડીપી આઈડી, ક્લાઈન્ટ આઈડી સામે સભ્યનો મોબાઈલ નંબર નોધાયેલો હોય તો સભ્ય આ પ્રમાણેનો SMS મોબાઈલ નંબર 9212993399 પર મોકલી શકે છે. MYEPWD<space>E-voting Event Number (EVEN) + Folio No. or DP ID Client ID

દા.ત. NSDL માટે: MYEPWD<SPACE> IN12345612345678 CDSL 412: MYEPWD < SPACE > 1402345612345678

ભૌતિક સ્વરુપ: MYEPWD<SPACE> 90711234567890

- જો ફોલીઓ નંબર/ડીપી આઈડી ક્લાઈન્ટ આઈડી સામે સભ્યનો ઇ-મેઈલ આઈડી નોધાયેલો હોય તો સભ્ય કેફિન ના હોમપેજ https://evoting.kfintech.com પર "forgot password" ક્લિક કરીને ફોલીઓ નંબર / ડીપી આઈડી, ક્લાઈન્ટ આઈડી અને PAN દાખલ કરીને પાસવર્ડ મેળવી શકે છે.
- સભ્યો evoting@kfintech.com પર ઈમેલ વિનંતી મોકલી શકે છે.
- જો સભ્ય પહેલેથી જ કેફીન ના ઈ-વોટિંગ પ્લેટફોર્મ પર નોંધાયેલ હોય તો તે સભ્ય તેના વર્તમાન યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ રિમોટ ઈ-વોટિંગ દ્વારા મત આપવા કરી શકે છે.
- સભ્યો કોઈપણ સ્પષ્ટતા / સહાય માટે કેફિન ને ટોલ ફ્રી નંબર 1-800-309-4001 પર કૉલ કરી શકે છે.

(સી) રિમોટ ઇ-વોર્ટીંગ અંગે સુયનાઓ

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૮ અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ ની સમયાંતરે સધારેલી જોગવાઇઓના પાલનમાં, લિસ્ટિંગ રેગ્યુલેશન્સ ના રેગ્યુલેશન ૪૪ અને લિસ્ટેડ એન્ટોટીઝ ધ્વારા ઇ-વોટિંગ ની સવલત પુરી પાડવા અંગે ના સેબીના તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૦ ના પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD/CIR/P/2020/242 ("સેબી ઇ-વોટિંગ પરિપત્ર") સાથે વાંયતા કંપની દ્વારા સભ્યો, સભા માં પ્રસ્તાવિત ઠરાવો ઉપર તેમનો મત આપવાના અધિકાર નો ઇલેક્ટ્રોનિક માધ્યમ થી કેફીન ધ્વારા નિયોજિત ઈ-વોટિંગ ની સુવિધા મારફતે ઉપયોગ કરી શકશે. રિમોટ ઈ-વોટિંગ વૈકલ્પિક છે. રિમોટ ઈ-વોટિંગના સંદર્ભમાં શેરધારકોને નીયેની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે:

- સભ્યો સભાના સ્થળ સિવાયના સ્થળેથી ઇલેક્ટ્રોનિક વોટિંગ ("રિમોટ ઇ-વોટિંગ") સિસ્ટમનો ઉપયોગ કરીને એજીએમ નોટિસમાં નિર્ધારિત તમામ ઠરાવો પર તેમનો મત આપી શકે છે.
- રિમોટ ઇ-વોર્ટીંગનો સમયગાળો સોમવાર, રર સપ્ટેમ્બર રન્શપ ના સવારે ૯.00 કલાક (IST) થી બુધવાર, ર૪ સપ્ટેમ્બર રન્શ્ય ના સાંજે પ.00 કલાક (IST) સુધીનો **રહેશે.** આ સમયગાળા દરમ્યાન, કટ-ઓફ તારીખ મુજબ, ભૌતિક સ્વરૂપે અથવા ડીમેટ સ્વરૂપે સંપૂર્ણ યૂકવણી કરેલા શેર ધરાવતા કંપનીના સભ્યો ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપી શકે છે. ત્યારબાદ કેફીન ધ્વારા રિમોટ ઇ-વોર્ટીંગ મોડ્યુલ મતદાન માટે નિષ્ક્રિય કરવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા બાદ, તેમાં ફેરફાર કરવાની અથવા ફરીવાર મત આપવાની મંજૂરી આપવામાં આવશે નેહીં. રીમોટ ઈ-વોટીંગ દ્વારા પોતાનો મત આપનાર સભ્યો વીસી / ઓએવીએમ દ્વારા સભામાં હાજરી આપી શકે છે, પરંતુ ઠરાવો પર કરીથી તેમનો મત આપવા માટે હકદાર રહેશે નહીં.
- સેબીના ઈ-વોટિંગ પરિપત્રના સંદર્ભમાં, તમામ વ્યક્તિગત ડીમેટ એકાઉન્ટ ધારકો માટે, તેમના ડીમેટ એકાઉન્ટ્સ / ડિપોઝિટરીઝ / ડિપોઝિટરી સહભાગીઓની વેબસાઇટ્સ દ્વારા, એક જ લોગિન ઓળખપત્ર દ્વારા ઈ-વોર્ટિંગ પ્રક્રિયા સક્ષમ કરવામાં આવી છે.
- ઇ-વોટીંગ માટેની પધ્યતિ અને સૂચનાઓનો કંપનીની વેબસાઇટ (www.suzlon.com) પર અને કેફિનની વેબલિંક (https://evoting.kfintech.com) પર પ્રસિધ્ધ કરવામાં આવેલી એજીએમની નોટિસ માં, સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત તે માહિતી નેશનલ સ્ટોક એક્સયેન્જ ઓફ ઈન્ડિયા લીમીટેડ (www.nseindia.com) અને બીએસઇ લીમીટેડ (www.bseindia.com) ની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

વીસી / ઓએવીએમ દ્વારા સભામાં હાજરી આપવા અને સભા ના સ્થળેથી મતદાન અંગેની સૂચનાઓ: (ડી)

- સભ્યો, વીસી / ઓએવીએમ દ્વારા સભામાં હાજરી આપી શકશે અથવા https://emeetings.kfintech.com/ પર તેમના રીમોટ ઈ-વોટિંગ લોગિન પાસવર્ડ નો ઉપયોગ કરીને, EVEN પસંદ કરીને, સભાનું લાઈવ વેબકાસ્ટ જોઈ શકશે.
- જે સભ્યો પાસે ઇ-વોર્ટિંગ માટે યુઝર આઈડી અને પાસવર્ડ નથી અથવા યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છે તેઓ એજીએમની નોટિસમાં દર્શાવેલ રીમોટ ઈ-વોર્ટિંગ સૂચનાઓનું પાલન કરીને તેને પુનઃપ્રાપ્ત કરી શકે છે. વધુમાં, સભ્યો ઈ-વોટિંગ સિસ્ટમમાં લોગિન કરવા માટે ઓટીપી આધારિત લોગિનનો પણ ઉપયોગ કરી શકે છે.
- વીસી / ઓએવીએમ દ્વારા સભામાં જોડાવાની સુવિધા સભા માટે નિર્ધારિત સમયના ૩૦ (ત્રીસ) મિનિટ પહેલા ખુલશે અને સમગ્ર સભા દરમ્યાન ખુલ્લી રાખવામાં આવશે. સભ્યો વીસી / ઓએવીએમ મારફતે સભામાં વેહલા તે પહેલાના ધોરણે ભાગ લઈ શકશે. ૧૦૦૦ શેરધારકો વેહલા તે પહેલાના ધોરણે સભામાં જોડાઈ શકશે.
- જે સભ્યો કટઑફ તારીખ ના રોજ શેર ધરાવતા હોય અને જે સભા દરમ્યાન તેમના મંતવ્યો રજુ કરવા અથવા પ્રશ્નો પૂછવા માંગતા હોય તેઓ સોમવાર, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના સવારે ૯.00 કલાક (IST) થી બુધવાર, ર૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના સાંજે ૫.00 કલાક (IST) સુધીમાં https://emeetings.kfintech.com ઉપર સ્પીકર રજીસ્ટ્રેશન ઉપર ક્લીક કરીને તેમને સ્પીકર તરીકે રજીસ્ટર કરી શકશે. જે સભ્યો એ સ્પીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવેલ છે ફક્ત તેઓને જ સભા દરમ્યાન મંતવ્યો રજુ કરવા / પ્રશ્નો પૂછવા દેવામાં આવશે. સભાના સરળ સંચાલન માટે કંપની પ્રશ્નોની સંખ્યા અને વક્તાઓની સંખ્યાને મર્યાદિત કરવાનો અધિકાર અનામત રાખે છે. વૈકલ્પિક રીતે, કટ-ઓફ તારીખે શેર ધરાવતા સભ્યો https://emeetings.kfintech.com ઉપર 'પોસ્ટ યોર ક્વેરીઝ' પર ક્લિક કરીને તેમાં આપેલી વિન્ડોમાં તેમના નામ, ડીમેટ એકાઉન્ટ નંબર / ફોલિયો નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નો ઉલ્લેખ કરીને તેમના વ્યુઝ / પ્રશ્નો પોસ્ટ કરી શકે છે. વિન્ડો બુધવાર, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના સાંજે ૫.00 કલાકે (IST) બંધ થઇ જશે. શેરધારકો તેમના પ્રશ્નો investors@suzlon.com પર ઇમેઇલ દ્વારા પણ મોકલી શકે છે.
- સભા દરમ્યાન ઇ-વોટીંગ માટેની પ્રક્રિયા રીમોટ ઇ-વોટીંગ માટેની પ્રક્રિયા જેવી જ છે કારણ કે સભા વીસી / ઓએવીએમ દ્વારા યોજવામાં આવી રહી છે. સભા દરમ્યાન સભાના અધ્યક્ષની સુચનાઓ મુજબ ઈ-વોટિંગ વિન્ડો સક્રિય કરવામાં આવશે. સભા દરમ્યાન ઇ-વોટિંગ વીસી / ઓએવીએમ પ્લેટફોર્મ સાથે સંકલિત છે અને તેના માટે અલગ લોગિનની જરુર નથી. રિમોટ ઈ-વોટિંગ, વીસી / ઓએવીએમ મારફતે સભામાં હાજરી આપવા અને સભામાં મતદાન માટે વિગતવાર પ્રક્રિયા એજીએમ નોટિસ માં પૂરી

નિષ્પક્ષ અને પારદર્શક રીતે સભામાં રિમોટ ઇ-વોટિંગ પ્રક્રિયા અને ઇ-વોટિંગની યકાસણી માટે સ્ક્રૂટિનાઈઝર તરીકે પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી શ્રી ડી એસ એમ રામ નિયુક્ત કરવામાં આવ્યા છે. રીમોટ ઈ-વોર્ટીંગ, વીસી / ઓએવીએમ દ્વારા સભામાં હાજરી આપવા અને સભા દરમ્યાન ઇ-વોર્ટીંગ ને લગતી કોઈપણ જાણકારી માટે સભ્યો https://evoting.kfintech.com ઉપર ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ Help & Frequently Asked Questions (FAQs) and 'AGM VC / OAVM' user manual નો સંદર્ભ લઇ શકે છે અથવા ટોલ-ફ્રી નંબર ૧-૮૦૦-૩0૯-૪૦૦૧ અથવા ઇ-મેઈલ એડ્રેસ: evoting@kfintech.co; પર શ્રી દ્ન્યાનેશ ધરોટે, વાઇસ પ્રેસિડેન્ટ, કેફિનનો સંપર્ક કરી શકે છે.

સૂઝલોન એનર્જી લીમીટેડ વતી સહી/-ગીતાંજલી એસ વૈદ્ય,

કંપની સેક્રેટરી

indianexpress.com

I arrive at a conclusion not an assumption.

Inform your opinion detailed analysis.



The Indian Express. For the Indian Intelligent.

૨૯ ઓગસ્ટ ૨૦૨૫

પુણે